

ફો.પરચુ.અરજી નં.૩૨૯૮/૨૩

**: આંક-૧ હેઠળ હુકમ :**

(૧) ફરીયાદી/અરજાદારે મુળ ફરીયાદ સાથે હાલની ડીલે કોન્ડોન અરજી દાખલ કરતા પરચુ.અરજી તરીકે રાખવાનો હુકમ કરવામા આવેલ અને આરોપી/ સામાવાળાને નોટીસ ઈસ્યુ કરવાનો હુકમ કરવામા આવતા ફરીયાદી તરફે આરોપી/સામાવાળાને આર.પી.એડી.થી કોર્ટની નોટીસ મોકલ્યાની પોસ્ટલ ખાતાની સ્લીપ તથા નોટીસનુ પરત ફરેલ કવર રજુ કરેલ છે. આરોપીને નોટીસ બજી જવા છતા આરોપી/સામાવાળા મુદ્દતે હાજર રહેલ નથી તેમજ કોઈ રીપોર્ટ પણ રજુ કરેલ નથી જેથી તેઓનો હકક બંધ કરી તેઓને સાંભળવામા આવેલ નથી.

(૨) ફરીયાદીએ હાલની અરજી કરી નેગો.એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરવામા થયેલો દિન-૧૨ નો વિલંબ માફ કરી ફરીયાદ દાખલ કરવા માટે પરવાનગી આપવા વિનંતિ કરેલ છે. અરજદાર/ફરીયાદીના જણાવ્યા મુજબ આ કામના આરોપીને તા.૨૯/૯/૨૩ ના રોજ મોકલેલ સદર નોટીસનુ કવર તા.૭/૧૦/૨૩ ના રોજ પરત ફરેલ. ત્યારબાદ ફરીયાદએ આ કમાના આરોપીને વોટસએપના માધ્યમથી તા.૧૯/૧૦/૨૩ ના રોજ નોટીસની બજવણી કરેલ, જે નોટીસનો જવાબ આરોપીએ ફરીયાદીને તા.૨૩/૧૦/૨૩ ના રોજ આપેલ જે જવાબમા આરોપી નાઓ ફરીયાદીને તેમની લેણી નીકળતી રકમની ચકુવણી કરી આપશે તેવુ પાકુ વચન અને વિશ્વાસ આપેલ જે બાબતે ફરીયાદએ મીત્રતાના દવો આરોપીને

૧૫ દિવસનો સમય આપેલ, ૧૫ દિવસ પુરા થયા બાદ પણ આરોપીએ તેમની લેણી નીકળતી રકમ ચુકવવા દરકાર કરેલ નહીં અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધેલ. જેથી ફરીયાદી સદર ફરીયાદ ટાઈમસર દાખલ કરી શકેલ નહીં જેથી ફરીયાદ દાખલ કરવામા વિલંબ થયેલ છે જે વિલંબ માફ કરવા વિનંતિ કરેલ છે.

(૩) ફરીયાદીના વિ.વ.શ્રીની દલીલો તથા રેકર્ડ ધ્યાને લીધુ. નેગો.એક્ટની જોગવાઈ મુજબ ચેક પરત થયેથી આરોપીને માંગણાની નોટીસ નીચત સમય દિન-૩૦ માં આપવાની રહે છે. નોટીસ મળ્યા બાદ મુદત સમયમાં નાણા નહીં ચુકવતા પંદર દિવસનો સમય બાદ કરી ત્યારબાદ દિન-૩૦ મા ફરીયાદ દાખલ કરવુ આવશ્યક છે હાલની ફરીયાદ વંચાણે લેતા ચેક તા.૬/૮/૨૦૨૩ ના રોજ પરત થતા માંગણાની નોટીસ તા.૨૮/૦૮/૨૦૨૩ ના રોજ કરેલ જે નોટીસ વાળુ કવર તા.૭/૧૦/૨૦૨૩ ના રોજ પરત ફરેલ છે અને તે હકીકતે ફરીયાદ દાખલ કરવામા દિન-૧૨ નો વિલંબ થયેલ હોવાનુ જણાઈ આવે છે.

(૪) હવે વિલંબ માફી મુદ્દે ફરીયાદીના વિ.વ.શ્રીની દલીલો ધ્યાને લઈ નેગો.એક્ટની કલમ ૧૩૮(બી)ની જોગવાઈ ધ્યાને ધ્યાને લેવામા આવે તો ડીમાન્ડ નોટીસ આરોપીને મળ્યેથી જો ચેક લખનાર દિન પંદરમા ચેકની રકમ મુજબના નાણા ચેકદારકને ચુકવવામા કસુર કરે તો ત્યારબાદથી એક મહીનામાં ફરીયાદ દાખલ કરવાની રહે છે પરંતુ ફરીયાદ દાખલ કરવામા બાર (૧૨) દિવસનો વિલંબ થયેલાનુ અરજદારે જણાવેલ છે.

નેગો.એક્ટની જોગવાઈ ધ્યાને લેતા ફરીયાદની એ ફરજ છે કે ફરીયાદ કાયદાએ ઠરાવેલ સમયમા દાખલ કરવી જોઈએ પરંતુ જ્યારે ફરીયાદી તે મુદત સમયમા દાખલ કરી ન શકે અને જો તે અંગેના પુરતા વ્યાજબી અને

સંતોષકારક કારણો જણાવે તો કોર્ટ તે માટે થયેલ વિલંબ માફ કરી શકે અને ફરીયાદ દાખલ કરવામાં થયેલ વિલંબ માફ કરી ફરીયાદ દાખલ કરવા અનુમતિ આપી શકે છે. ફરીયાદી તરફથી વિલંબ માફ કરવા માટે જણાવવામાં આવેલ કારણો ધ્યાને લેવામાં આવે તો ફરીયાદી જણાવે છે કે, આ કામના આરોપીને તા.૨૯/૯/૨૩ ના રોજ મોકલેલ સદર નોટીસનું કવર તા.૭/૧૦/૨૩ ના રોજ પરત ફરેલ. ત્યારબાદ ફરીયાદએ આ કામના આરોપીને વોટસએપના માધ્યમથી તા.૧૯/૧૦/૨૩ ના રોજ નોટીસની બજવણી કરેલ, જે નોટીસનો જવાબ આરોપીએ ફરીયાદીને તા.૨૩/૧૦/૨૩ ના રોજ આપેલ જે જવાબમાં આરોપી નાઓ ફરીયાદીને તેમની લેણી નીકળતી રકમની ચકુવણી કરી આપશે તેવું પાકુ વચન અને વિશ્વાસ આપેલ જે બાબતે ફરીયાદએ મીત્રતાના દવો આરોપીને ૧૫ દિવસનો સમય આપેલ, ૧૫ દિવસ પુરા થયા બાદ પણ આરોપીએ તેમની લેણી નીકળતી રકમ ચુકવવા દરકાર કરેલ નહીં અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધેલ. જેથી ફરીયાદી સદર ફરીયાદ ટાઈમસર દાખલ કરી શકેલ નહીં જેથી ફરીયાદ દાખલ કરવામાં વિલંબ થયેલ છે. પરંતુ સદર કારણ વિલંબ માફ કરવા માટે પુરતું અને વ્યાજબી કારણ જણાતું નથી અને જો આ અરજી મંજૂર કરવામાં આવે તો સદર કાયદામાં ઠરાવેલ સમય મર્યાદાનો કોઈ અર્થ રહે નહીં. જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો "**2016(0) AIJEL-HC 236571, Tamarind Info Private Limited Vs. State of Gujarat**" ઠરાવેલ સિદ્ધાંત તથા અરજી ધ્યાને લેતા અરજીમાં જણાવેલ વિલંબ માફીના કારણો તથા કેસની હકીકતોને ધ્યાને લેતા કેસ દાખલ કરવામાં થયેલ વિલંબ માફ કરવા માટેના પુરતા વ્યાજબી અને સંતોષકારક કારણો જણાઈ આવતા ન હોય ફરીયાદ દાખલ કરવામાં થયેલો વિલંબ માફ કરવાનું ન્યાયોચિત જણાઈ આવતું નથી જેથી નીચે મુજબનો હુકમ ફરમાવવામાં આવે છે.

**:: હુકમ ::**

ફરીયાદીની હાલની ફરીયાદ દાખલ કરવામાં થયેલ બાર (૧૨) દિવસની ઢીલ(વિલંબ) માફની અરજી નામંજૂર કરવાનો હુકમ કરવામાં આવે છે.

હુકમ આજરોજ તા.૦૭, માહે : મેં, સને ૨૦૨૬ ના રોજ ખુલ્લી અદાલતમા વાંચી સંભળાવી જાહેર કર્યો.

તા.૦૭/૦૫/૨૦૨૬  
રાજકોટ

(બિપીનભાઈ નારણભાઈ શ્રીવાસ્તવ)  
ચોથા અધિક ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ,  
(સ્પે. નેગો. કોર્ટ), રાજકોટ  
જી.જે.-૦૧૧૦૨